

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

જાહેરાત ક્રમાંક : ૧૧૪/૨૦૧૬૧૭ અન્વયે, વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડાની કચેરી અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સની કચેરી, ગાંધીનગર હસ્તકની “હિસાબનીશ” વર્ગ-૩ સંવર્ગની જગ્યા માટેના ભરતી નિયમોની જોગવાઈઓને આધિન રહીને મંડળે તા.૨૫-૦૩-૨૦૧૮ના રોજ યોજેલ લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા તથા તા.૧૦-૦૮-૨૦૧૮ના કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ બાદ તા.૨૬-૧૧-૨૦૧૮ રોજ પ્રમાણપત્રોની ચકાસણીના કાર્યક્રમના અંતે ઉમેદવારોએ મેળવેલ ગુણના આધારે પસંદગી યાદી તેમજ પ્રતિક્ષા યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવેલ ઉમેદવારોના નામ મેરીટ અગ્રતાનુસાર અનુક્રમે ANNEXURE-J અને ANNEXURE-K માં તા.૦૬/૧૨/૨૦૧૮ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતું.

૨(૧). સદરહું “હિસાબનીશ” વર્ગ-૩ સંવર્ગની જગ્યા માટેની ભરતી પ્રક્રિયાના માંગણાપત્રક મુજબ શારીરિક અશક્ત ઉમેદવાર માટે ૦૧ (એક) જગ્યા અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિની ખામીવાળા વિકલાંગો માટેની અનામત જગ્યા તથા અન્ય ૦૧(એક) શ્રવણની ખામીવાળા વિકલાંગો માટે એમ કુલ - ૦૨(બે) જગ્યા અનામત રાખવામાં આવેલ છે. પરંતુ જાહેરાત ક્રમાંક : ૧૧૪/૨૦૧૬૧૭ અન્વયે મંડળની કચેરી તરફથી જે અંતિમ પરિણામ તા.૦૬/૧૨/૨૦૧૮ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ તે સિલેક્ટ લીસ્ટમાં ૦૧ (એક) જગ્યા અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિની ખામીવાળા વિકલાંગો માટેની અનામત હોવા છતાં તથા શ્રવણની ખામીવાળા વિકલાંગો ઉમેદવાર ઉપલબ્ધ નહીં થવાના કારણોસર પસંદગી યાદીમાં એક PH(ORTHO) તથા પ્રતિક્ષાયાદીમાં ૦૧(એક) PH(ORTHO) ઉમેદવાર શરતયુક્તથી પસંદ પામેલ છે. તથા અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિની ખામીવાળા વિકલાંગ ઉમેદવાર શ્રી કિરીટસિંહ નારણસિંહ વાઘેલા, General PH(Blindness) ઉપલબ્ધ હોવા છતાં તેઓશ્રીનું નામ શરતયુક્તથી પસંદગી યાદીમાં દાખલ કરવાનું રહી ગયેલ છે.

૨(૨). સબબ, ૦૧ (એક) જગ્યા અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિની ખામીવાળા વિકલાંગો માટેની અનામત હોવાના કારણોસર તથા આ કેટેગરીના ઉમેદવાર શ્રી કિરીટસિંહ નારણસિંહ વાઘેલા, General PH(Blindness) ઉપલબ્ધ હોઈ, REVISED SELECT LIST OF CANDIDATES (સુધારેલ પસંદગી યાદી) ANNEXURE-J માં ક્રમાંક : ૪૧ ઉપર સમાવવામાં આવે છે. જયારે શ્રવણની ખામીવાળા વિકલાંગો માટે ૦૧ (એક) જગ્યા અનામત રાખવામાં આવેલ હોવા છતાં આ કેટેગરીના એકપણ ઉમેદવાર ઉપલબ્ધ થતા ન હોઈ, આ જગ્યા સામે, PH(ORTHO) કેટેગરીના ૦૧(એક) ઉમેદવારને પસંદ કરવામાં આવે છે. ઉપરાંત સુધારેલ કટ ઓફ માર્ક્સ ધ્યાને લેતાં તા.૦૬/૧૨/૨૦૧૮ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ પસંદગી યાદીના ક્રમાંક : ૩૭ ઉપરના General PH(ORTHO.) કેટેગરીના ઉમેદવાર શ્રી રાજેશકુમાર મણીલાલ પટેલ ને આ પસંદગીયાદીમાંથી બહાર કાઢીને શ્રી પટેલને REVISED WAITING LIST OF CANDIDATES (ANNEXURE-K) માં ક્રમાંક : ૧૧ ઉપર સમાવવામાં આવે આવે છે.

૨(૩). તા.૦૬/૧૨/૨૦૧૮ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ પ્રતિક્ષા યાદી (ANNEXURE-K) ઉપરના ક્રમાંક - ૧૨ના ઉમેદવાર RUKHAD KHIMABHAI JOLIYA (M/SEBC) એ PH/ORTHO.+ Sports કેટેગરીમાં Online અરજી કરેલ હતી. પરંતુ તા.૨૬-૧૧-૨૦૧૮ના રોજ પ્રમાણપત્રો ચકાસણી વખતે શ્રી જોલીયા નિયત નમૂનાનું રમતગમતનું પ્રમાણપત્ર રજૂ કરવામાં નિષ્ફળ ગયેલ હતાં. જેથી તેઓશ્રીએ ભાગ-૧ ની લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણ (રમતગમતના ૩.૨૩ ગુણ બાદ કરતાં) કટ ઓફ માર્ક્સ કરતાં પણ ઓછા ગુણ મેળવેલ હોઈ, RUKHAD KHIMABHAI JOLIYA (M/SEBC) (PH/ORTHO.) ને પ્રતિક્ષાયાદી (ક્રમાંક-૧૨) માંથી ગેરલાયક (DISQUALIFIED) કરવામાં આવે છે.

૩. ઉપરોક્ત વિગતો ધ્યાને લઈ, પરિણામમાં સુધારા વધારા કરવાની જરૂરીયાત જણાતા; અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સની કચેરી, ગાંધીનગર હસ્તકની “હિસાબનીશ” વર્ગ-૩ સંવર્ગની જગ્યા માટેની પસંદગી યાદી તેમજ પ્રતિક્ષા યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવેલ ઉમેદવારોના નામ મેરીટ અગ્રતાનુસાર આથી અનુક્રમે REVISED SELECT LIST OF CANDIDATES (ANNEXURE-J) અને REVISED WAITING LIST OF CANDIDATES (ANNEXURE-K) તથા REVISED LIST OF ABSENT / DISQUALIFIED CANDIDATES IN DOCUMENT VERIFICATION માટે સુધારેલ ANNEXURE-A લીન્ક ફાઇલ પર આથી મૂકવામાં આવેલ છે. જે સંબંધિત ઉમેદવારોને જોઈ લેવા માટે આથી જણાવવામાં આવે છે.

સ્થળ:- ગાંધીનગર
તારીખ : ૨૮/૦૧/૨૦૧૯

સચિવ,
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ,
ગાંધીનગર.